

ત્વરિત જાહેરાત માટે

**બ્રેમ્પટન અમોન્ગ ફર્સ્ટ કેનેડિયન સીટીસ ટૂ જોઈન ShopHERE
ઈન સર્પોર્ટ ઓફ લોકલ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસીસ
(બ્રેમ્પટન કેનેડાના સૌ પ્રથમ શહેરોમાંનું એક છે જે સ્થાનિક સ્વતંત્ર ધંધાઓને સહાયરૂપ થવા
ShopHERE સાથે જોડાશે)**

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 29, 2020) – બ્રેમ્પટન તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ShopHERE (શોપ હીયર) કાર્યક્રમમાં પોતાની સહભાગિતાની ઘોષણા કરનાર કેનેડાના સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પૈકી એક છે.

ShopHERE, એ કાર્યક્રમ છે જે ડિજિટલ મેઈન સ્ટ્રીટ દ્વારા Google (ગૂગલ), Shopify (શોપિફાય), Mastercard (માસ્ટર કાર્ડ), Microsoft (માઈક્રોસોફ્ટ), Facebook (ફેસબુક), eBay (ઈ-બે), અને eShipper (ઈ-શિપર) જેવા વિકેતાઓ સાથેના સહયોગમાં રજૂ કરવામાં આવ્યો, અને સીટી ઓફ ટોરોન્ટોમાં તે પહેલી વખત શરૂ થયો અને તે સ્થાનિક સ્વતંત્ર ધંધાઓ અને કલાકારોને કોઈ ખર્ચ વગર ઓનલાઈન સ્ટોરફ્રન્ટ્સ બનાવવાની સર્વિસ પૂરી પાડે છે. ગઈકાલે, ગૂગલે દેશભરમાં આ કાર્યક્રમ શરૂ કરવા \$1 મિલિયનની કટિબદ્ધતાની ઘોષણા કરી, અને બ્રેમ્પટન સૌથી પહેલા સામેલ થનાર શહેરોમાંનું એક છે.

સ્વતંત્ર ધંધાઓ અને કલાકારો COVID-19 થી થયેલા પ્રભાવો સાથે સમાયોજન કરવાના પ્રયત્નોમાં છે અને પોતાના કામધંધાઓ ઓનલાઈન ખસેડી રહ્યાં છે ત્યારે, કેટલાક ધંધાઓને શરૂઆત કરવામાં સહાયતાની જરૂર પડે છે. સ્થાનિક ધંધાઓને પોતાના ઉત્પાદો કે સેવાઓનું વેચાણ કરવાનું ચાલુ રાખવા જરૂરી ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં અને ગ્રાહકો સુધી નવી રીતોથી પહોંચવામાં ShopHERE મદદરૂપ થાય છે.

ShopHERE કાર્યક્રમના ભાગરૂપે, ધંધાઓને પોતાના માટે ખાસ માહિતી અને બ્રાન્ડિંગવાળો પોતાનો ઓનલાઈન સ્ટોર ગ્રાહકલક્ષી બનાવવાની પસંદગી મળે છે. તેઓ પોતાનો ઓનલાઈન સ્ટોર સ્થાપવામાં અને શરૂ કરવામાં, અને ડિજિટલ માર્કેટિંગ, શિપિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પોતાના માટે સહાયતા મેળવવામાં તાલીમ માટે પણ સહાયતા મેળવે છે.

ShopHERE કાર્યક્રમમાં સહભાગી થવા, ધંધાઓ પાસે અચૂક 10 કરતા ઓછાં કર્મચારીઓ, અથવા જો ધંધો ફ્રેંચ, રેસ્ટોરન્ટ કે બારનો હોય તો 25 કરતા ઓછાં કર્મચારીઓ હોવા રહ્યા. કોઈ ફ્રેન્ચાઈઝી કે ચેઈનનો ભાગ હોય તેવા ધંધાઓ આ કાર્યક્રમ માટે પાત્ર નથી.

મે 13 નાં રોજ, શહેર માટે સ્થાનિક અર્થતંત્ર ફરી શરૂ કરવા આગળ વધવા માટેના માળખા તરીકે, [બ્રેમ્પટન કાઉન્સિલે ઇકોનોમિક રિકવરી સ્ટ્રેટેજીને મંજૂરી આપી](#). સ્થાનિક ધંધાઓ COVID-19 થી થયેલા પ્રભાવો સામે પ્રતિક્રિયા કરી રહ્યાં છે ત્યારે તેઓને સહાયરૂપ થવા, સીટી આ વ્યૂહરચનાના ભાગ તરીકે સંખ્યાબંધ તાત્કાલિક પહેલોમાંથી એક ShopHERE ને અમલમાં લાવશે.

ધંધાઓ સહભાગી થવા અહીં અરજી કરી શકે છે <https://digitalmainstreet.ca/shophere/>.

અવતરણો (ક્વોટ્સ):

“આપણાં સ્થાનિક ધંધાઓ આપણાં સમુદાયનો મુખ્ય આધાર છે, અને તેઓએ COVID-19 થી થયેલા પ્રભાવોથી સારી પેઠે સહન કર્યું છે. અમે ટેકઆઉટ વેડનરેસમાં સહભાગી થાવ અને તાજેતરમાં શરૂ કરેલી અમારી સર્પોર્ટ સ્થાનિક બ્રેમ્પટન ઝુંબેશ સહિત, તેઓને સહાયરૂપ થવા સખત મહેનત કરી રહ્યાં છીએ. હું આપણાં શહેરની ShopHERE માં સહભાગિતાની ઘોષણા કરવામાં રોમાંચ અનુભવું છું. હું આપણાં સ્વતંત્ર ધંધાઓ અને કલાકારોને અરજી કરવા અને તેઓ પાસે ઉપલબ્ધ સંસાધનોનો પૂરેપૂરો લાભ લેવા તેઓને પ્રોત્સાહિત કરું છું.”

– પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“અમે સમગ્ર COVID-19 કટોકટી દરમિયાન આપણાં ધંધાદારી સમુદાય સાથે નિયમિતપણે જોડાયેલા રહ્યાં છીએ, અને અમે ઘણાં ધંધાઓ પાસેથી તેઓ સામનો કરી રહ્યાં હોય તેવા દેખીતા અલંઘનીય (પહોંચી વળવામાં વધારે પડતા) પડકારો વિશે સાંભળ્યું છે. તેઓએ અમને જાણાવ્યું છે કે તેઓને પોતાની ડિજિટલ ઉપસ્થિતિ વધારવા સહાયતાની જરૂર છે અને અમે તેઓની વાતને ધ્યાનમાં લીધી છે. તેઓને પોતાની ઓનલાઇન ધંધાદારી ઓફરો વધારવામાં અને નવા ધંધાકીય મોડેલો વિકસાવવામાં મદદરૂપ થવા ShopHERE એક ઉત્તમ ઉકેલ છે. અમને બહુ ગૌરવ થાય છે કે સ્થાનિક કંપની eShipper સંખ્યાબંધ ભાગીદારોમાંની એક છે જેઓએ આ રાષ્ટ્રીય પહેલને ટેકો આપવા સહી કરી છે.”

– પૉલ વિસેંટ (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; કો-લીડ (સહ-આગેવાન), મેયરનો COVID-19 આર્થિક સહાયતા ટાર્ક ફોર્સ

“આપણે આર્થિક રિકવરી કરવા આગળ વધી રહ્યાં છીએ ત્યારે, અમે બ્રેમ્પટનના અર્થતંત્રને ગતિ આપવા અને આપણાં ધંધાકીય સમુદાયને સહાયતા પૂરી પાડવા વિવિધ કાર્યક્રમો અને અભિગમોનો અમલ કરીશું. ShopHERE એવી જ એક પહેલ છે જે આપણાં ધંધાઓએ આગળ વધવા પોતાના અભિગમો પર પુનર્વિચાર કરવા માટે જરૂરી સહાયતા ઊભી કરવામાં અમને મદદરૂપ થશે.”

– માઇકલ પાલેશી (Michael Palleschi), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6; કો-લીડ (સહ-આગેવાન), મેયરનો COVID-19 આર્થિક સહાયતા ટાર્ક ફોર્સ

“હંમેશની જેમ, અમારા કર્મચારીઓ ભાગીદારીઓ કરવા અને નવીનતમ અભિગમો અમલમાં મૂકવા કટિબદ્ધ છે જેથી આપણાં રહેવાસીઓ અને ધંધાકીય સમુદાયને સેવા આપવામાં મદદરૂપ થઈ શકાય. ShopHERE આપણી સંસ્થા અને આપણાં સ્વતંત્ર ધંધાઓ અને કલાકારો માટે ઉત્તમ રીતે બંધ બેસે છે.”

– ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca